

B.Com. Semester - 5 (CBCS) Examination**March/April– 2019****FUNDAMENTALS OF INVESTMENTS - 1(DISC. SPE. ELE -1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ રોકાણ પર્યાવરણ વિશે તમે શું સમજો છો? રોકાણકારોનું વર્ગીકરણ સમજાવી, રોકાણના નિર્ણયોને (20)
અસરકરતા પરિબલો વર્ણવો.

અથવા

પ્રશ્ન-૧ રોકાણ નિર્ણય પ્રક્રિયા વિગતવાર સમજાવી અને રોકાણના પ્રકાર તરીકે કોમોડિટીઝ(Commodities) (20)
અને રિયલ એસ્ટેટ (Real Estate) પર નોંધ લખો.

પ્રશ્ન-2 નોંધ લખો:

(1) જામીનગીરી પરનો વ્યાપાર (Trading of Securities) (10)

(2) જામીનગીરી બજાર સૂચકાંક (Security Market Index) (10)

અથવા

પ્રશ્ન-2 નોંધ લખો:

(1) નાણાકીય માહિતીના પ્રાપ્તિસ્થાનો (10)

(2) વળતર પર ફુગાવાની અસર (Inflation Impact on Return) (10)

પ્રશ્ન-3 નિશ્ચિત આવક ધરાવતી જામીનગીરીનો ખ્યાલ આપી, બોન્ડસનો અર્થ, લક્ષણો તથા પ્રકાર વર્ણવો (15)

અથવા

પ્રશ્ન-3 બોન્ડ મૂલ્યાંકન અને બોન્ડ જોખમોના પ્રકારો વિસ્તારપૂર્વક વર્ણવો. (15)

પ્રશ્ન-4 ઇક્વિટી વિશ્લેષણ(Equity Analysis) નો અર્થ આપી મૂળભુત વિશ્લેષણ (Fundamental Analysis) (15)
અને ટેકનીકલ વિશ્લેષણ (Technical Analysis) વિષે લખો.

અથવા

પ્રશ્ન-4 કાર્યક્ષમ બજાર પૂર્વધારણા (Efficient Market Hypothesis) અને ડિવિડન્ડ મૂડીકરણ મોડેલ (15)
(Dividend Capitalization Models) પર વિસ્તૃત નોંધ લખો.

ENGLISH VERSION

Que-1 What do you mean by Investment Environment? Explain the Classification of Investors & Describe the factors affecting Investment Decisions. (20)

OR

Que-1 Explain the Investment Decision process in detail and also Write on Commodities & Real Estate as Types of Investments. (20)

Que-2 Write on:

(1) Trading of Securities (10)

(2) Security Market Index (10)

OR

Que-2 Write on:

(1) Sources Financial Information (10)

(2) Inflation Impact on Return (10)

Que-3 Give the concept of Fixed Income Securities Explain the Meaning, Features & Types of Bonds. (15)

OR

Que-3 Write in details on Bond valuation and types of bond Risks. (15)

Que-4 Given the meaning of Equity Analysis. Write on Fundamental Analysis and Technical Analysis. (15)

OR

Que-4 Write detail notes on Efficient Market Hypothesis and Dividend Capitalization models. (15)
